

ત્વરિત જાહેરાત માટે

પરિવહન, આરોગ્ય અને ભાવિ સમૃદ્ધિની હિમાયત માટે: AMO 2022 વાર્ષિક સામાન્ય સભા અને કોન્ફરન્સ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (12 ઓગસ્ટ 2022) – ઓગસ્ટ 14મી થી 17મી સુધી સિટી ઓફ બ્રેમ્પટનનું પ્રતિનિધિ મંડળ 2022 અસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીઝ (AMO) વાર્ષિક સામાન્ય સભા અને કોન્ફરન્સમાં સહભાગી થશે. મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)ના નેતૃત્વ હેઠળ કાઉન્સિલના સભ્ય અને સિટીના સત્તાધારીઓ, સરકારના મંત્રીઓ, સત્તાધારીઓ અને પ્રાંતના મહત્વના હિસ્સાધારકો સાથે બ્રેમ્પટન માટે સૌથી અગત્યના મુદ્દાઓ પર વિચારવિમર્શ કરશે.

જ્યારે શહેર COVID-19ની મહામારીમાંથી બહાર આવી રહ્યું છે અને વધુ મજબૂત બ્રેમ્પટન બનાવવા કાર્યરત છે ત્યારે તેની પ્રાથમિકતાઓમાં મુખ્ય એટલે સમુદાય વધુ સ્વાસ્થ્યપ્રદ રહે, વિકસે અને સમૃદ્ધ બને. આમાં સામેલ છે:

- **વધુ સારું પરિવહન** – પ્રવર્તમાન સેવા જાળવવી, વ્યુહાત્મક હરિયાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવું અને ઉચ્ચ કક્ષાના પરિવહનને વિકસાવવો.
- **આરોગ્ય સંભાળમાં સુધારા** – સમુદાયની વર્તમાન અને વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બ્રેમ્પટનની આરોગ્ય સંભાળના અંતરને દૂર કરવા માટે તાત્કાલિક ભંડોળ મેળવવું.
- **અર્થતંત્રને મજબૂત કરવું** – શહેરના ઈનોવેશન અને તકનિકી પરિવર્તનને સમર્થન આપવું, ઉચ્ચ કક્ષાના રોકાણોને આકર્ષવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પરિયોજનાઓને ઝડપી બનાવવી અને સમાવેશીતા સુનિશ્ચિત કરવી.
- **આબોહવા અંગેના પગલાં અને ટકાઉપણાનું પ્રદર્શન** - આબોહવાના પગલાંને અગ્રિમતા આપવી, જેમાં સામેલ છે પરિવહન અને સક્રિય પરિવહનના અવસરો, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનો ઘટાડવા, ઊર્જા કાર્યક્ષમતા પર કેન્દ્રિત રહેવું અને કુદરતી સ્થળો અને શહેરના વૃક્ષોને પુનર્જીવિત કરવા.
- **આવાસ મેળવવાની વધુ તકો ઊભી કરવી** – આવાસ સમસ્યાને વ્યાપક ધોરણે સંબોધિત કરવી જેથી રહેવાસીઓ સુનિશ્ચિતપણે પોષાય એવા આવાસ મેળવી શકે, આવાસને વધુ કિંમતી બનાવવા જે આવાસની વધુ પસંદગીઓ ઊભી કરીને થઈ શકે અને યોગ્ય પ્રકારના આવાસ પુરવઠો આપનારને પ્રોત્સાહિત કરવા.

સિટીની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ વિશે જાણવા [અહીં](#) ક્લિક કરો.

સુવાક્યો

“બ્રેમ્પટન કેનેડાના 25 સૌથી મોટા શહેરોમાં સૌથી ઝડપથી વિકસતું શહેર છે, જેમ કે આપણે COVID-19 મહામારીમાંથી શીખેલા પાઠનો અમલ કરવાનું ચાલુ રાખીએ છીએ, અમે એક વિકાસ પામતો અને સમૃદ્ધ સમુદાય છીએ તેની ખાતરી કરવા માટે સરકારના અન્ય સ્તરો સાથે

મજબૂત અને અસરકારક સહયોગ બનાવવા માટે સમર્પિત છીએ. . પ્રાંત દ્વારા અમને આ ટર્મ ઓફ કાઉન્સિલ દરમિયાન જે સહયોગ અને આપણા શહેરને સુધારવાની પ્રતિબદ્ધતા મળી છે તે માટે હું આભારી છું હું તેઓ સાથે અને તમામ ભાગીદારો સાથે બ્રેમ્પટનના આ જબરદસ્ત સંભાવનાને સાકાર કરવા માટે કાર્ય કરવા ઉત્સુક છું.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટનના કર્મચારીઓ ટર્મ ઓફ કાઉન્સિલની પ્રાથમિકતાઓને ટેકો આપીને પરિણામો આપવા પ્રતિબદ્ધ છે: હિમાયતની તકો પર ધ્યાન કેન્દ્રિત કરીને અને અમારા રહેવાસીઓ માટે સૌથી વધુ મહત્વના પ્રોજેક્ટ્સ અને પહેલને આગળ વધારવા માટે અમારા સરકારી ભાગીદારો સાથે સહયોગ કરીને બ્રેમ્પટન તે એક સારી રીતે ચલાવવાનું શહેર છે. પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયોમાં અમે જે કાર્ય કરીએ છીએ તે આપણા શહેરના ભવિષ્યમાં અતિમહત્વની ભૂમિકા ભજવે છે. અમે કોન્ફરન્સ વખતે અમારા આથીદારો સાથે પ્રવૃત્ત થવા ઉત્સુક છીએ અને આપણા સમુદાય માટેની મહત્વની પ્રાથમિકતાઓની ચર્ચા કરવા માંગીએ છીએ.

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર , સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ , અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca